

પરિશિષ્ટ બી – મતદાર શિક્ષણ અને આઉટરીય યોજનાની વિગતો

કાઉન્ટી ઓફ Santa Clara રજિસ્ટ્રાર ઓફ વોટર્સ (ROV) કાઉન્ટીના રહેવાસીઓ વચ્ચે મતદાર જોડાણ વૈવિધ્ય ઊભું કરવા પ્રતિબદ્ધ છે. આ મતદાતા શિક્ષણ અને આઉટરીય યોજના વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપે છે જેને સામૂહિક ભાગીદારીમાં વધારો કરવાના, નાગરિક સામેલગીરીની તકો વિસ્તૃત કરવાના અને મત કેન્દ્રના મોડેલ સાથે મતદાતાનો અનુભવ સુધારવાના લક્ષ્ય સાથે હાથ ધરી શકાય છે. મતદાર નોંધણી અને ભાગીદારીમાં વધારો કરવા માટે દર વર્ષે નીચેની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

આઉટરીયના પ્રકારો:

- પરંપરાગત આઉટરીય: નીચે સૂચિબદ્ધ પ્રવૃત્તિઓ મતદાર શિક્ષણના પ્રકારો અને આઉટરીય પ્રયત્નોનું પ્રતિનિધિત્વ કરે છે, ચૂંટણીઓ નિર્ધારિત થયેલ હોય કે ન હોય પરંતુ ROV વર્ષ દરમિયાન ભાગ લે છે અને આયોજન કરે છે. આ પ્રવૃત્તિઓ પર, ROV મતદાતા શિક્ષણ સાહિત્ય, નાગરિક અને સ્થાનિક સરકારી સંસાધનો, મતદારોના રજિસ્ટ્રારની બ્રાન્ડેડ આઉટરીય સામગ્રી અને લોકોને ઊંડાણપૂર્વકની ચર્ચા પૂરી પાડે છે.
 - ટેબલિંગ – સંસાધનો, સાહિત્ય, મતદાર શિક્ષણ, મતદાર નોંધણી અને ચૂંટણી અધિકારીની ભરતી પૂરી પાડવા માટે મોટાભાગની સામાન્ય આઉટરીય ઇવેન્ટ્સ ટેબલિંગ હેઠળ આવે છે
 - હોસ્ટિંગ બૂથ – મોટા આઉટડોર ઇવેન્ટ્સ, તહેવારો અને સંમેલનોની વિનંતી મુજબ, અમે સંસાધનો, સાહિત્ય, મતદાર શિક્ષણ, મતદાર નોંધણી અને ચૂંટણી અધિકારીની ભરતી પ્રદાન કરીએ છીએ
 - મતદાર નોંધણી તાલીમ – વ્યક્તિગત/સંસ્થાની વિનંતી મુજબ, અમે રાજ્ય સચિવની સામગ્રીના આધારે મતદાર નોંધણી અભિયાનોનું આયોજન કેવી રીતે કરવું તે વિશે તાલીમ પ્રદાન કરીએ છીએ
 - મતદાર શિક્ષણ પ્રસ્તુતિઓ – વિનંતી/સંસ્થાઓ મુજબ મતદાર શિક્ષણ પ્રસ્તુતિઓમાં મતદાર પસંદગીના કાયદાના ફેરફારો, સિવિક્સ 101, મતદાન અધિકારો અને મત આપવા માટે કેવી રીતે નોંધણી/પૂર્વ નોંધણી કરાવી શકાય તેનો સમાવેશ થાય છે
 - હાઇ સ્કૂલ મતદાર નોંધણીના અભિયાનો – ઉચ્ચ શાળાઓ સાથે મતદાર નોંધણી અભિયાનોના આયોજનમાં સંકલન અને મદદ કરવી
 - નેટવર્કિંગ/સિવિક ઇવેન્ટ્સ – સામૂહિક કાર્યક્રમોમાં હાજરી અને ભાગીદારી નિર્માણ અને વિવિધ સિટી ચેમ્બર ઓફ કોમર્સ, સિટી કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ્સ, વગેરે માટે સહાયક કાર્યક્રમો કરવા
- મતદારની પસંદગી અધિનિયમ-વિશિષ્ટ આઉટરિય: ROV મતદારની પસંદગી અધિનિયમ હેઠળ અમલમાં મૂકાયેલા ફેરફારો અંગે મતદારોને શિક્ષિત કરવાનું ચાલુ રાખશે. નીચે સૂચિબદ્ધ પ્રવૃત્તિઓ

ROV આયોજન કરશે, તેમાં ભાગ લેશે અને Santa Clara કાઉન્ટીના સભ્યો અને સંગઠનો સાથે સહયોગ કરશે તે આઉટરીચ પ્રયત્નોના પ્રકારો રજૂ કરે છે:

- રજૂઆતો
- ચર્ચાઓ અથવા પ્રશ્નોત્તરી સત્રો
- ભાગીદારી નિર્માણ (CBOs સાથે વ્યક્તિગત રૂપે મીટીંગો)
- વર્કશોપ્સ (ભાષા અને એક્સેસિબિલિટીની જરૂરિયાતો ધરાવતા સામૂહિક જૂથો માટે)
- ટ્રેન-ધ-ટ્રેનર પ્રોગ્રામ્સ (ટીટીટી) (સંદેશને વ્યક્તિગત કરવા અને વિસ્તૃત કરવા માટે આઉટરીચ પાર્ટનર્સને તાલીમ આપવી)
- મતદાન સાધનો/મશીન ડેમોન્સ્ટ્રેશનો

બ્રાંડિંગ/સંદેશ: કાઉન્ટી ઓફ Santa Claraએ મત કેન્દ્રો અને તેઓ જે સેવાઓ આપે છે તેના વિશેની પ્રોત્સાહિત માહિતીને પ્રાધાન્યતા આપવાનો જાગૃત નિર્ણય લીધો છે, જેમાં મેલ મતપત્રક દ્વારા મત મેળવનારા દરેક મતદાર વિશેની માહિતીનો સમાવેશ થાય છે. ROV મતદારની પસંદગી અધિનિયમ (VCA) દ્વારા સૌથી વધુ પ્રભાવિત મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે: મતદાતાઓ કે જેઓ રૂબરૂમાં મત આપવાનું પસંદ કરે છે.